



Date : July 03, 2020

The Manager
Listing Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai - 400 001
Fax: +91 22 2272 2082/3132
BSE Code: 533704

Essar Shipping Limited
Essar House
11 K. K. Marg
Mahalaxmi
Mumbai - 400 034
India

Corporate Identity Number
L61200GJ2010PLC060285

T +91 22 6660 1100
F +91 22 2354 4312
www.essar.com

The Manager
Listing Department
National Stock Exchange of India Limited
"Exchange Plaza"
Bandra Kurla Complex
Bandra (E)
Fax: +91 22 2659 8237/38
Mumbai - 400 051
NSE Code: ESSARSHPNG

The Manager
Wholesale Debt Department
National Stock Exchange of India Limited
"Exchange Plaza"
Bandra Kurla Complex
Bandra (E)
Fax: +91 22 2659 8237/38
Mumbai - 400 051
NSE Code: ESSARSHPNG

Dear Sir / Madam,

SUBJECT: ADVERTISEMENTS IN NEWSPAPER

With reference to the captioned subject, please find enclosed, extract of newspaper publication of the Financial Results for the quarter and Financial Year ended March 31, 2020 as required under regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) 2015.

Kindly approve the same and take it on your record.

Thanking you,

For Essar Shipping Limited

Sd/-

Jyotsna Gupta
Company Secretary & Compliance Officer
Membership No. ACS-23899

Aadhar Housing Finance Ltd.

Corporate Office: 201, Raheja Point-1, Near Shamrao Vitthal Bank, Nehru Road, Vakola Santacruz (E), Mumbai-400055.

Vadodara Branch : Office No. - 404, 4th Floor, Atlantis Complex, Opp. Petrol Pump, Sarabhai Road, Vadodara-390001 (Gujarat). Contact 8866188800

PROPERTY FOR SALE UNDER PROVISIONS OF SARFAESI ACT, 2002 THROUGH PRIVATE TREATY

Whereas the Authorised Officer, Aadhar Housing Finance Limited (AHFL) has taken the Possession u/s 13(4) of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (The SARFAESI Act, 2002) of the property bearing ("the Secured Asset") given below.
The Authorised Officer has received offer of Sale from some interested party against the above mentioned Secured Asset under the SARFAESI Act for recovery of the Secured Debt. Now, the Authorised Officer is hereby giving the Notice to Sale of the above said property through Private Treaty in terms of rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules 2002. The Details of the Account are as follows:

Loan App.No.	Name of the Borrower/ Co-Borrowers	Demand Notice Date & Amount	Reserve Price (RP)	Earnest Money Deposit (EMD)	Total Outstanding Loan Amount as on date (29.06.2020)	Description of the Secured Asset
(App No. 00109684/Vadodara Branch)	Shivakumar Khushalbhai Rathva (Borrower) Sangitaben Shivkumar Rathva (Co-Borrower)	19-04-2019 ₹ 6,28,823/-	₹ 9,00,000/- (Rs. Nine Lakh only)	₹ 90,000/- (Rs. Ninety Thousand Only)	₹ 7,25,650/- (Rs. Seven Lakh Twenty Five Thousand Six Hundred Fifty Only)	All that part & parcel of property bearing, Plot No. 185, At. Jambughoda, off Jambughoda Road, Opp. Jambughoda Rest House, Panchmahal, Panch Mahal, Gujarat-389390 Boundaries: East: Common Plot, West: Plot No.184, North: Plot No.186, South: 6 Meter Road

The Authorised officer will hold auction for sale of the Secured Asset on 'As is where is Basis', 'As is what is basis' and 'Whatever is there is basis'. AHFL is not responsible for any liabilities whatsoever pending upon the said property. The Authorised Officer reserves the right to accept or reject the offer without assigning any reason whatsoever and sale will be subject to confirmation by Secured Creditor. On the acceptance of offer of proposed buyer, he/she is required to deposit 25% of accepted price inclusive adjustment of Earnest Money Balance immediately and the balance amount shall be paid by the purchaser within 15 (fifteen) days from date of acceptance of Offer by the Secured Creditor. The proposed buyer is to note that in case of failure of payment of balance amount by him/her within the time specified, the amount already deposited shall stand forfeited and property will be resold accordingly.
This is 15 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT, 2002 is hereby given to the public in general and in particular to the Borrower (s), Co-Borrower (s) and Guarantor (s) that the above described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of Aadhar Housing Finance Limited (AHFL) Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" and to the amount due to Aadhar Housing Finance Ltd., in full before the date of sale, auction is liable to be stopped.
The Date of Auction is fixed for 16.07.2020
Place : Vadodara, Date : 29.06.2020

(Authorised Officer)
For Aadhar Housing Finance Limited

POSSESSION NOTICE - (for immovable property) Rule 8-(1)

Whereas, the undersigned being the Authorized Officer of IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFHL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, a Demand Notice was issued by the Authorised Officer of the company to the borrowers / co-borrowers mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 3 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IIFHL for an amount as mentioned herein under with interest thereon.
"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, if the borrower clears the dues of the "IIFHL" together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or transferred by "IIFHL" and no further step shall be taken by "IIFHL" for transfer or sale of the secured assets.

Name of the Borrower(s)	Description of secured asset (immovable property)	Total Outstanding Dues (Rs.)	Date of Demand Notice	Date of Possession Notice
Surat & Baroda BRANCH Sandeep Arun Patil, Samsadhan, Arun Patil, Lilabhai Patil, Akash Patil (Prospect No. / Loan A/c No. 827224)	All that piece and parcel of property being Plot No. 67, Aradhana, Dream-4, Jolwa, Palsana, Surat, Gujarat. Bounded:- On the North by:- Plot No. 66, On the South by:- Plot No. 68, On the East by:- Plot No. 30, On the West by:- Society Road	Rs. 13,82,442/-	02-Nov-19	26-Jun-20
Mr.Sohansing Madhusing Bhati and Mrs.Puspakunwar Sohansing Bhati (Prospect No. / Loan A/c No. 815796)	All that piece and parcel of Plot No.144, Shree Mateshwari Resi, Haldharu, Surat, Gujarat, India	Rs. 10,96,995/-	12-Mar-20	26-Jun-20
Mr. DILIPBHAI M BHANGI, Mrs. Ashaben Dilipbhai Bhanghi (Prospect No. / Loan A/c No. 878652)	All that piece and parcel of Unit No. C-145, "Golden Valley", Near Amodar Giriraj Road, Waghadia Main Road, Vadodara, Gujarat-390019.	Rs. 16,33,667/-	30-Oct-19	27-Jun-20

For further details please contact to Authorised Officer at Branch Office: Office no.- Office No. 701, 7th Floor, 21st Century Business Center, Near Udhna Darwaja, Ring Road, Surat - 395002 and 303, Third Floor, Gold Croft Complex, 65-66, Vishwas Colony, Opp. Swagat Restaurant, Jetalpur Road, Vadodara-390007/ Corporate Office: Plot No. 98, Phase-IV, Udayog Vihar, Gurgaon, Haryana.

Place: Surat & Baroda Dated: 30/06/2020 Sd/- Authorised Officer, For IIFL Home Finance Limited

IFB INDUSTRIES LIMITED

CIN: L51109WB1974PLC029637
Regd. Office: 14, Taratala Road, Kolkata- 700 088
Ph: 033-30489299, Fax: 033-30489230
Email: investors@ifbglobal.com
Website: www.ifbindustries.com
NOTICE
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a meeting of the Board of Directors of IFB Industries Limited will be held on **Monday, the 6th July, 2020** to consider and take on record the Audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and financial year ended 31 March, 2020 beside other matters.
The information contained in this notice is also available on the Company's website www.ifbindustries.com and also on the website of Stock Exchanges viz. Bombay Stock Exchange Ltd - www.bseindia.com and National Stock Exchange of India Ltd - www.nseindia.com
By order of the Board
For IFB Industries Limited
G Ray Chowdhury
Company Secretary
Place : Kolkata Date: 29.6.2020

Andhra Pradesh State FiberNet Limited

(An enterprise of the Government of Andhra Pradesh) VJAYAWADA
Proposals are invited from interested agencies for Procurement & Supply of SFP Modules and Patch Cords for AP Fiber Grid Network. Details may be downloaded from the website: www.apsfl.in or e-procurement platform. All other details will be uploaded only on the website of APSFL or e-procurement platform. For any queries Email: apsfl@ap.gov.in
Sd/- Executive Director

APPENDIX-IV POSSESSION NOTICE [See Rule-8(1)]

Whereas (For immovable property)
The undersigned being the Authorised Officer of the Bank of India, M.G. Road Branch, Vadodara under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **07.11.2019** calling upon the **Smt. Anitaben Suryakant Sushir, borrower and wife of Late Mr. Suryakant Anandao Sushir, co-borrower** to repay the amount mentioned in the notice being **Rs. 8,70,119.22 (In words Rupees Eight Lakh Seventy Thousand One Hundred Nineteen and Paise Twenty Two)** within 60 days from the date of receipt of the said notice.
The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **24th day of June 2020**.
The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of India** for an amount of **Rs. 8,70,119.22** and interest thereon.
The borrower's attention is invited to the provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All that part and parcel of the property owned by **Smt. Anitaben Suryakant Sushir and Late Mr. Suryakant Anandao Sushir**, being Flat No. C/601, Sixth Floor in Block No. C, adm. 49.00 Sq. Mtr. built up area under Mukhya Mantri Aavas Yojna (VMSS), Scheme No. B-9, LIG Aavas Yojna, Old Pramukhswami Hospital, Atladara, Vadodara situated at Survey No./Final Plot No. 95 of T P Scheme No. 20 (Presently Known as Neelkanth Residency) within the limit of Vadodara, Village Moje Atladara, Taluka and Dist. Vadodara in the State of Gujarat within the jurisdiction of the Sub Registrar Vadodara. **Bounded as :-** On or towards East by : Society Road, On or towards West by : Staircase, On or towards North by : Block D, On or towards South by : C-602.
Sd/-
Date : 24.06.2020, Place : Vadodara Authorised Officer, Bank of India

बैंक ऑफ बड़ोदा Bank of Baroda

SME BHAVNAGAR BRANCH :
Madhav Hill, Waghwadi Road, Bhavnagar - 364 001.
E-mail : ssibha@bankofbaroda.co.in

Possession Notice

Whereas, The undersigned being the Authorised Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated **02.01.2020** calling upon the Borrower Late Mr. Maheshkumar Jethanand Kurekja and Mrs. Barkhaben Maheshkumar Kurekja to repay the amount mentioned in the notice being sum Rs. 3,83,802.85/- (Rupees Three Lakh Eighty Three Thousand Eight Hundred Two and Paise Eighty Five Only) Plus Other Charges and interest thereon at the contractual rate plus cost, charges and expenses within 60 days from the date of receipt of the said notice.
The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this **26th day of June of the year 2020**.
The Borrower/Guarantor/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of sum **Rs. 3,83,802.85/- (Rupees Three Lakh Eighty Three Thousand Eight Hundred Two and Paise Eighty Five Only)** Plus Other Charges and interest thereon at the contractual rate plus cost, charges and expenses till date of payment.
The borrower's attention is invited to sub-section (8) of Section 13 in respect of time available to redeem the secured assets.
DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES
Shop situated in Old Encroachment No. 74 of Plot No. 1978, Area Known as "Rasala Camp", Bhavnagar, City Survey No. 2836/E, Ward No. 6, Admeasuring 9.45 Sq. Mts., which is bounded on all the four sides as follows :
On East : Others Proeprty
On West : Others Proeprty
On North : Shutter of said property and waghawadi road
On South : Others Proeprty
Date : 26.06.2020 Authorised Officer & Chief Manager,
Place : Bhavnagar Bank Of Baroda

SHILCHAR TECHNOLOGIES LIMITED

Regd. Office : Bil Road, Bil 391 410 Dist. Vadodara, Gujarat. Phone : (0265) 268 0466, 268 0566
Fax : (0265) 268 0611 Email : info@shilchar.com, Website : shilchar.com
CIN : L29308GJ1986PLC008387
EXTRACT OF STANDALONE AUDITED RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ENDED 31st MARCH 2020 (Rs. In Lacs except per Share Data)

Sr. No.	Particulars	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
		Quarter Ended 31st March, 2020	Quarter Ended 31st December, 2019	Quarter Ended 31st March, 2019	Year Ended 31st March, 2020	Year Ended 31st March, 2019
1	Total Income from Operations (Net)	1,807.79	1,989.73	3,015.33	7,426.55	12,005.80
2	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and/or Extraordinary Items)	76.13	22.96	153.43	198.95	1,067.24
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or Extraordinary Items)	76.13	22.96	153.43	198.95	1,067.24
4	Net Profit / (Loss) for the period (After Tax, Exceptional and/or Extraordinary Items)	59.29	15.68	116.72	149.77	774.53
5	Total Comprehensive Income for the period (Profit/Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	24.09	16.33	121.05	116.52	777.12
6	Paid-up Equity share capital of Rs. 10 each	381.34	381.34	381.34	381.34	381.34
7	Reserve (Excluding Revaluation Reserve) as shown in the Audited Balance of the previous year.	-	-	-	5,733.24	5,708.52
8	Earnings per share of Rs.10/- each for continuing and discounted operations)					
a. Basic		1.55	0.41	3.06	3.93	20.31
b. Diluted		1.55	0.41	3.06	3.93	20.31

NOTES : (1) The above results were reviewed by the Audit Committee and have been approved by Board of Directors at their respective meetings held on 27th June, 2020 at Village Bil, Dist.Vadodara. (2) The Board of Directors of the Company has recommended the Dividend of 10% (Rs.1 per share) on Equity Shares of Rs.10 each for the year ended 31st March 2020, subject to approval of Shareholders. (3) The above is an extract of the detailed format of Quarter Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the consolidated quarterly financial results are available on stock exchange website : www.bseindia.com and on Company's website : www.shilchar.com.
By order of the Board of Directors
For SHILCHAR TECHNOLOGIES LIMITED
Sd/-
ALAY SHAH
CHAIRMAN & MANAGING DIRECTOR
Date : 27th June, 2020
Place : Village, Bil, Dist. Vadodara

बैंक ऑफ बड़ोदा Bank of Baroda

POSSESSION NOTICE (Immovable & Movable property)
Whereas, The undersigned being the Authorised officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice dated **02-03-2020** calling upon the borrower **M/s.Virtuous Core & Engitech Pvt. Ltd.** to repay the amount mentioned in the notice being **Rs.2,81,68,851.07/(Rupees Two Crores Eighty One Lakhs Sixty Eight Thousand Eight hundred Fifty One and Paise Seven Only)** and interest thereon w.e.f. 28.02.2020 within 60 days from the date of receipt of the said notice.
The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this **25th day of June of the year 2020**.
The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda, Sayajigunj Branch, Vadodara** for an amount of **Rs.2,81,68,851.07/(Rupees Two Crores Eighty One Lakhs Sixty Eight Thousand Eight hundred Fifty One and Paise Seven Only)** and interest thereon.

Description of the Immovable Property
1 .Equitable Mortgage of factory land and building situated at R.S.no. 80 paikee 7, Khata I No.593, paikee shed No. 1 admeasuring 2143.58.73 sq.mtrs. at Village Madhwas Tal Kalol,Dist Panchmahal standing in name of Mr.Rahul Kumar Jagdishbhai Patel bounded as under: East: Shed No 2 & 3 & Land bearing R.S.No. 81, West: Land bearing R.S.No. 79, North : land nearing R.S.No. 80/5, South:Road. Hypothecation of Stock and book debts, plant and machineries and etc.

Equitable Mortgage of factory land and building situated at R.S.no.80 paikee 7, Khata No. 593, paikee shed no. 2, admeasuring 818.68.02 sq.mtrs.at Village Madhwas Tal Kalol, Dist Panchmahal standing in name of Mrs.Bhumikaben Rahul Kumar Patel bounded as under: East: Shed No 3 and Land Bearing R.S.No. 81, West: Road & Shed No 1, North : Land bearing R.S.No. 80/4 & 80/6, South : Road. Hypothecation of Stock and book debts, plant and machineries and etc.

Equitable Mortgage of factory land and building situated at R.S.No. 80 paikee 7, Khata no. 593, paikee shed No. 3 admeasuring 952.05 sq.mtrs. at Village Madhwas Tal Kalol, Dist Panchmahal standing in the name of Mrs.Shardaben Jagdishbhai Patel bounded as under: East: Remaining land bearing R.S.No. 81, West:Compound wall of Quality Steel, North :Remaining Land bearing R.S.No. 80/P, South :Sariyam Naliya Road. Hypothecation of Stock and book debts, plant and machineries and etc.

Equitable Mortgage of House no. 15-B, Nand Bungalows Society, shamladevi Road, Kalol behind Canara bank situated at R.S.No. 125 paikee 2 Plot No. 15, admeasuring 99.48 sq.mtrs standing in the joint names of Mrs.Shardaben J. Patel and Mr.Rahul Kumar J.Patel bounded as under: East: Road towards Plot, West: land of Sub Plot No 7, North : 6 mtrs Road, South : Road towards Plot. Hypothecation of Stock and book debts,plant and machineries and etc.

Hypothecation of entire Raw Materials, Stock-in-Process, Stores & Spares, consumables Packing Materials, Finished Goods and Book-debts of the Firm, Machineries, Equipments, Electrical Installations, Furniture & Fixtures, Office Equipments and other Movable Fixed Assets of the Firm, situated at factory land and building situated at R.S.No. 80 paikee 7, Khata no 593 paikee shed No.3 admeasuring 952.05 sq.mtrs, at Village Madhwasjal Kalol. Dist Panchmahal standing in the name of Mrs.Shardaben Jagdishbhai Patel, factory land and building situated at R.S.no.80 paikee 7, Khata No. 593, paikee shed no. 2, admeasuring 818.68.02 sq.mtrs at Village Madhwas Tal Kalol, Dist Panchmahal standing in name of Mrs.BhumikabenRahul Kumar Patel and factory land and building situated at R.S.no. 80 paikee 7, Khata No.593 paikee shed No.1 admeasuring 2143.58.73 sq.mtrs. at Village Madhwas Tal Kalol,Dist Panchmahal standing in name of Mr.Rahul Kumar Jagdishbhai Patel. Hypothecation of Stock and book debts, plant and machineries and etc.

Place : Vadodara, Date : 25-06-2020 Authorised Officer, Bank of Baroda

ESSAR SHIPPING LIMITED

Regd. Office: EBTSL Premises, ER-2 Building (Admin Building) Salaya, 44 KM. P.O. Box No.7, Taluka Khambalija, Devbhumi Dwarka, Gujarat - 361305
esl.secretarial@essarshipping.com, Website: www.essar.com, CIN: L61200GJ2010PLC060285
Head Office: Essar House, 11, Keshavnagar Khadye Marg, Mahalaxmi, Mumbai - 400 034

Statement of Standalone and Consolidated Audited Financial Results for the quarter and year ended 31 March, 2020

Sr. No.	Particulars	Standalone				Consolidated					
		Quarter ended		Year ended		Quarter ended		Year ended			
		31.03.2020	31.12.2019	31.03.2019	31.03.2020	31.03.2019	31.03.2020	31.12.2019	31.03.2019	31.03.2020	31.03.2019
1	Total income from operations	69.38	191.86	144.21	551.00	535.04	319.57	387.62	333.78	1,494.30	1,366.48
2	Net Loss for the period / year (before tax, exceptional items and extraordinary items)	(83.00)	(17.22)	(24.93)	(172.91)	(192.04)	(60.79)	(81.92)	(100.90)	(194.08)	(289.16)
3	Net Loss for the period / year before tax (after exceptional items and/or extraordinary items)	(2,862.42)	(17.22)	(1,424.93)	(2,952.33)	(1,592.04)	(1,545.19)	(89.18)	(3,587.87)	(1,685.74)	(3,776.13)
4	Net Loss for the period /year after tax (after exceptional items and/or extraordinary items)	(2,862.63)	(17.52)	(1,425.18)	(2,953.44)	(1,593.49)	(1,545.40)	(89.48)	(3,588.12)	(1,686.85)	(3,777.58)
5	Total comprehensive Loss net of tax	(2,861.81)	(17.50)	(1,424.51)	(2,950.53)	(1,592.07)	(1,538.82)	(95.26)	(3,581.18)	(1,683.94)	(3,769.89)
6	Paid-up equity share capital (face value of Rs.10/- each)	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98
7	Reserves (Excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	(2,955.90)	(8.26)	-	-	-	(4,428.44)	(2,116.51)
8	Earnings per share before exceptional items (EPS)										
	(a) Basic (in Rs.)	*(4.02)	*(0.85)	*(1.22)	(8.41)	(9.35)	*(2.67)	*(4.25)	*(4.59)	(9.43)	(13.74)
	(b) Diluted (in Rs.)	*(4.02)	*(0.85)	*(1.22)	(8.41)	(9.35)	*(2.67)	*(4.25)	*(4.59)	(9.43)	(13.74)
9	Earnings per share after exceptional items (EPS)										
	(a) Basic (in Rs.)	*(138.3)	*(0.85)	*(68.86)	(142.69)	(76.99)	*(74.38)	*(4.6)	*(173.06)	(81.5)	(182.21)
	(b) Diluted (in Rs.)	*(138.3)	*(0.85)	*(68.86)	(142.69)	(76.99)	*(74.38)	*(4.6)	*(173.06)	(81.5)	(182.21)

Note:
The above is an extract of the detailed format of Standalone & Consolidated Financial Result for the quarter and year ended 31 March, 2020 filed with stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and consolidated Audited Financial Results for the quarter and year ended 31 March, 2020, are available on the website of the Company, www.essar.com and website of the Exchange (www.bseindia.com and www.nseindia.com)

For Essar Shipping Limited
Sd/-
Capt. Rahul Bhargava
Director
Place: Mumbai
Date: 29 June, 2020

LUX INDUSTRIES LIMITED

CIN : L17309WB1995PLC073053
Regd. Office: 39, KALI KRISHNA TAGORE STREET, KOLKATA - 700 007
Email: info@luxinnerwear.com, Website:www.luxinnerwear.com, Ph : 033-40402121, Fax : 033-40012001

Promises and performances that ensure comfort

Extract Of Audited Financial Results For The Quarter And Year Ended 31st March, 2020

PARTICULARS	STANDALONE				CONSOLIDATED			
	QUARTER ENDED		YEAR ENDED		QUARTER ENDED		YEAR ENDED	
	31.03.2020	31.03.2019	31.03.2020	31.03.2019	31.03.2020	31.03.2019	31.03.2020	31.03.2019
Total income from operations (net)	28,640.94	39,118.79	1,20,690.60	1,21,787.85	28,824.85	39,120.39	1,20,989.93	1,21,609.03
Net Profit / (Loss) before exceptional items and tax	4,169.74	5,743.25	16,696.86	15,464.14	4,089.17	5,664.56	16,344.72	15,211.25
Net Profit / (Loss) after exceptional items before tax	4,169.74	5,743.25	16,696.86	15,464.14	4,089.17	5,664.56	16,344.72	15,211.25
Net Profit / (Loss) after tax attributable to the owners of the Company	3,055.31	3,763.49	12,601.30	10,131.39	3,015.41</			